



જનસંપર્ક અધિકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૧૦/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૯૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૨ કેસ કરી, ૮૦ વ્યક્તિઓને ઝડપી, ૧૯૩ લીટર દેશી દારૂ, ૩૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૭૨ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૧ મોટર સાયકલ અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૧ વ્યક્તિની અટક કરી રોકડ રૂપિયા ૨૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૯૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૯૯૨/૧૮

**વસ્ત્રાપુર:** કલ્પેશભાઈ સુબોધભાઈ વખારીયા (ઉ.વ.૪૬)(રહે,ત્રીસલા ફ્લેટ, આનંદનગર સોસાયટી પાલડી) એ તા.૧૧/૧૦/૧૮ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે ઓગષ્ટ/૨૦૧૮ તથા સપ્ટેમ્બર/૨૦૧૮ દરમ્યાન વસ્ત્રાપુર નહેરૂપાર્ક બાલાજી કોમ્પ્લેક્ષ સી/૨ ખાતે આરોપી “નોવા ઇન્ફો ટેક” ના માલિક મિતુલ કૃષ્ણકાંન્ત દેસાઈ (રહે,શ્રીનગર સોસાયટી, સૌરાષ્ટ્ર ફરસાણા હાઉસ કૃષ્ણનગર) એ કલ્પેશભાઈ પાસેથી કુલ રૂપિયા ૧,૪૭,૯૯,૫૯૬/- નો માલ ખરીદ કરી, નાણા નહી ચુકવી, માલ બારોબાર વેચી નાસી જઈ કલ્પેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એસ.આર.ગામીત ચલાવે છે.

**સોલા હાઇકોર્ટ:** વિશ્વેશ સુભાશચંદ્ર પટેલ (રહે, અભિષેત બંગલોઝ, હોટેલ શાહીબાગ પાછળ ગિરધરનગર પાસે શાહીબાગ) એ તા.૧૧/૧૦/૨૦૧૮ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે ઓક્ટોબર/૨૦૧૭ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન નારોલ, કાશીરામ મીલ કંપાઉન્ડ ખાતે આવેલ કંપની “શંભુ ટેક્સટાઇલ મીલ્સ પ્રા.લી.” ના ડિરેક્ટર આરોપી નિલેશ અગ્રવાલ (રહે.મનવાર બંગલો શીલજ રાંચરડા રોડ, શીલજ) એ વિશ્વેશ પાસેથી વેપાર અર્થે રૂપિયા ૧૬,૬૮,૭૭૨/- નો માલ ખરીદ કરી માલના નાણા નહી ચુકવી, વિશ્વેશ સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.પટેલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૯૯૩/૧૮

વસ્ત્રાપુર: રેખાબહેન વા/ઓ સંજયભાઈ દંતાણી (રહે, નર્મદા આવાસ યોજનાના મકાનમા, સિંધુભવન રોડ બોડકદેવ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૧/૧૮ સાજના ૭/૩૦ થી તા.૧૧/૧૦/૧૮ સવારના ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૬,૪૧,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એસ.આર.ગામીત ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૯૯૪/૧૮

કૃષ્ણનગર: પ્રવિણભાઈ ચંપકલાલ મોદી (ઉ.વ.૪૮)(રહે, નંદ બંગલોઝ નોબલ સ્કુલ પાછળ કૃષ્ણનગર) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૧૦/૨૦૧૮ સાજના ૫/૩૦ થી ૬/૩૦ દરમ્યાન કૃષ્ણનગર બગીચા પાસે બાપા સીતારામની મઢુલીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પ્રવિણભાઈના પુત્રએ તેઓની ફોરવ્હીલ ગાડી ધોવા માટે આપેલ, જે ગાડીમાં મુકેલ રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- પૈકી ગાડીમાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- અજાણી વ્યક્તિએ ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.કે.દવેરા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.